

નામ:-

મો નં:-

તા:-

પ્રતિ ,

મુખ્ય સચિવશ્રી , સચિવાલય, ગાંધીનગર

માન. મુખ્ય મંત્રીશ્રી , સચિવાલય, ગાંધીનગર

અગ્ર સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત

જીલ્લા કલેટરશ્રીઓ/ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ

પોલીસ કમિશનરશ્રી , ગાંધીનગર, ગુજરાત

વિષય:- ભારતના બંધારણની કલમ 51 (a) હેઠળ જાગૃતિ અભિયાનની સૂચના.

સાદર પ્રણામ,

"જય ભારત" સાથે અમો ભારતનાં જાગૃત અને નિષ્ઠાવાન નાગરિક તરીકે આપ સાહેબશ્રી ને સવિનય સાથે જણાવવાનું કે આપ શ્રી અમારી સેવા અને મદદ માટે તથા અમારા સંરક્ષણ માટે નિયુક્ત થયેલ છે. જે અમારા માટે આવકારદાયક છે. તેમજ આપ આગળ પણ સદૈવ અમારી મદદ માટે તત્પર રહેશો એવી અમારી અપેક્ષાઓ છે.

આપ ગુજરાત સરકારના GSDMA દ્વારા તા:- 26/03/2020 ના રોજ મહામારી આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 લાગુ પાડેલ જે હજી સુધી લગાવેલ છે. આથી આ સ્થિતિમાં લોકોને કેટલીક બાબતો અંગે સમસ્યાઓ ઉદભવે એ સ્વાભાવિક છે, જેમ કે સ્વાસ્થ્ય , શિક્ષણ , ગરીબી રોજગારી , તેમજ પર્યાવરણ ને લાગતી સમસ્યાઓ વગેરે. એથી આવી ગંભીર પરિસ્થિતિમાં પણ સરકાર દ્વારા સકય બને તેટલું લોકોના કલ્યાણ અને મદદ માટે સદૈવ પ્રયત્નશીલ છે અને સાર્થક કામો કરી રહી છે. પરંતુ તેમ છતાં ગુજરાત ના તમામ લોકો ને તે પહોંચી વળે તેમ ન હોવાથી અમો એ જનહિત એવમ રાષ્ટ્ર ના નવનિર્માણ અને સંરક્ષણ માટે અમારી જાતને તન, મન અને ધન થી તેમની મદદ માટે સમર્પિત કરી " જન જાગૃતિ અભિયાન" ચાલવાનું નક્કી કરેલ છે. જે અમારી ભારત દેશના જિંમેદાર નાગરિક તરીકેની ફરજ છે , જે નિભાવી જરૂરી છે. આથી અમે આ બાબતની જાણ નીચે મુજબ કરીએ છીએ.

➤ અમે ભારતના બંધારણના અનુસાર આપેલ મૂળભૂત હકો (19) 1) Right to freedom of speech and expression.

2) Right to assemble peaceably and without arms.

3) Right to form association or union or co operative societies.

4) Right to Move freely throughout the territory of India.

5) Right to practice any profession or to carry any occupation , business.

6) તેમજ આર્ટિકલ 21 A. Right to Life and personal liberty.

➤ તથા મૂળભૂત ફરજો ARTICLE 51(A) ના અનુસાર આ "જન જાગૃતિ અભિયાન " દ્વારા લોકોને આ બાબતો અંગે જાગૃત કરીશું જેમ કે,

1) કોરોના જેવી કે અન્ય બિમારીઓથી બચવા માટે લોકોને કઈ સાવચેતી રાખવી (જેમ કે માસ્ક , વેક્સિન જેવી બાબતોનું WHO, ICMR ,MOHFW ના પ્રોટોકોલ અને ગાઇડલાઈન મુજબ કઈ રીતે પાલન કરવું)તે અંગેની માહિતી આપવા માટે ની શિબિરો અને મિટિંગ કરીશું.

2) તેમજ લોકોને સ્વાસ્થ્ય કઈ રીતે રહેવું તે માટેની ભોજન પદ્ધતિ , યોગ , કસરત , ઘરેલુ તેમજ આયુર્વેદિક ઉપચાર અંગે ની શિબિરો યોજીશું.

3) તેમજ ભણતર અને શિક્ષા અંગેનું મહત્વ સમજાવવું , ભારતનાં બંધારણ અંગેનું જ્ઞાન અને આધ્યાત્મિક શિક્ષણ આપવું.

4) વધતી જતી બેરોજગારી અને ગરીબી ઘટાડવા માટે ના વ્યવસાયો તેમજ પ્રવૃત્તિઓ વિશે અવગત કરવા અને આર્થિક રીતે મજબૂત બને તે અંગેનું માર્ગદર્શન આપવું.

5) તેમજ કૃષિ ક્ષેત્રે અને પર્યાવરણ ના સ્વર્ધન અને વિકાસ અંગે નું માર્ગદર્શન અને જ્ઞાન આપવું. તે માટે વિવિધ શિબિરો અને મિટિંગ કરીશું.

- માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના" સબકા સાથ સબકા સાથ સબકા વિકાસ","સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત" અને "જય જવાન જય કિસાન " જેવા વિચારોને આગળ વધારવા માટે અમારો ભારતના જાગૃત અને જિંમેદાર નાગરિક તરીકે નો આ નાનો એવો પ્રયાસ કરીને યોગદાન આપવા માંગીએ છીએ.

- આથી આપ સાહેબશ્રી ને ખાસ નમ્ર નિવેદન છે કે આપ અમારા આ અભિયાન માં શક્ય બને તેટલો સહયોગ આપશો, એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આપ સાહેબ શ્રી અમારી આ વાત થી સર્વ સહમત છો એવું માનીએ છીએ. અંતે એટલુજ કહીને અમારી વાતને પૂર્ણવિરામ આપીએ છીએ કે આપના પ્રતિભાવ અને જવાબ ની અમે રાહ જોઈશું. " વંદે માતરમ્ "

ભારત દેશનો જિંમેદાર નાગરિક